

**B.A. Semester - 3 (CBCS) Examination****Oct/Nov - 2022 (OLD COURSE)****ECONOMICS OF MONEY & BANKING - 1(ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- 
- પ્રશ્ન.૧ નાણું એટલે શું? નાણાંના ઉત્ક્રાંતિ વિષે ચર્ચા કરો. (૧૪)  
અથવા
- પ્રશ્ન.૧ નાણાંનાં વિવિધ કાર્યોની સમજૂતી આપો.
- પ્રશ્ન.૨ ભાવ સૂચકાંક એટલે શું? ભાવ સૂચકાંકની રચના પદ્ધતિ સમજાવો. (૧૪)  
અથવા
- પ્રશ્ન.૨ શાખ સર્જન એટલે શું? શાખ સર્જનની પ્રક્રિયા સમજાવો.
- પ્રશ્ન.૩ પ્રો.ફિશરના નાણા પરિમાણના સિદ્ધાંતની સમજૂતી આપો. (૧૪)  
અથવા
- પ્રશ્ન.૩ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓના નાણાના રોકડ પુરાંતના સિદ્ધાંતની મર્યાદાઓની ચર્ચા કરો.
- પ્રશ્ન.૪ વ્યાપારી બેંકોના પ્રણાલિકાગત કાર્યોની સમજૂતી આપો. (૧૪)  
અથવા
- પ્રશ્ન.૪ ચેક એટલે શું? ચેકનાં લક્ષણોની સમજૂતી આપો.
- પ્રશ્ન.૫ ટુંકનોંધ (કોઇપણ-બે) (૧૪)
1. ચેકનું મહત્વ.
  2. નાણાંના વિવિધ ઘટકો.
  3. ખુલ્લા બજારની નીતિ.
  4. સુરક્ષિત ધિરાણના સિદ્ધાંતો.

**ENGLISH VERSION**

- Q.1 What is Money? Discuss the Evolution of Money. (14)  
OR
- Q.1 Explain the various functions of Money.
- Q.2 What is Price Index? Explain the method of formation of Price Index. (14)  
OR
- Q.2 What is Credit Creation? Explain the process of Credit Creation.
- Q.3 Explain Prof. Fisher's theory of Monetary Dimension. (14)  
OR
- Q.3 Discuss the limitations of the Cambridge Economists' cash flow theory of Finance.
- Q.4 Explain the systemic functions of Commercial Banks. (14)  
OR
- Q.4 What is a Cheque? Explain the characteristics of a Cheque.
- Q.5 Notes (Any-Two) (14)
1. Significance of Cheque.
  2. Different Components of Money.
  3. Open Market Policy.
  4. Principles of Secured Credit.

\*\*\*\*\*